

RAN-2308000106051015

T.Y.B.Com. (Non NEP) (Sem. VI) Examination March - 2026
Indirect Tax (Paper - VII)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) પ્રશ્ન ૧ ફરજિયાત છે. (3) બાકીના નીચે આપેલા ત્રણ પ્રશ્ન લખો.	Seat No.: <table border="1"> <tr> <td></td><td></td><td></td><td></td><td></td><td></td> </tr> </table> Student's Signature						

પ્ર.1. હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપો.

15

1. CBIT & Cનું લાંબુ સ્વરૂપ લખો.
2. ગ્રાહક કલ્યાણ ફંડ માટે કઈ કલમ લાગુ પડે છે?
અ. 57 બ. 75
ક. 58 ડ. 85
3. GST એક્ટ મુજબ કલમ 59 કોને લાગુ પડે છે?
અ. સ્વ આકારણી બ. ઓડિટ
ક. કામચલાઉ આકારણી ડ. રિફંડ
4. FOB નું લાંબુ સ્વરૂપ આપો.
5. CIF નું લાંબુ સ્વરૂપ આપો.
6. રીફંડ નીચેના પૈકી કોને મળવાપાત્ર છે?
અ. SEZ
બ. EXPORTER
ક. સયુક્ત રાષ્ટ્રસંઘ અથવા તેમણે જાહેર કરેલ સંસ્થા
ડ. ઉપરના તમામ
7. માલ કે સેવાના પુરવઠા માટે કઈ કલમ લાગુ પડે છે?
અ. કલમ 12 અને 13 બ. કલમ 12 અને 11
ક. કલમ 13 અને 14 ડ. કલમ 10 અને 11
8. CGST કોની સામે સરભર સરભર થતું નથી?
અ. CGST બ. SGST/UGST
ક. IGST ડ. GST
9. ઈનપુટ ટેક્સ કોને મળવાપાત્ર નથી?
અ. પટાવત વેરા માટે બ. બિનનિવાસી
ક. આકસ્મિક વેરાપાત્ર વ્યક્તિ ડ. ઉપરના તમામ
10. પત્રક નહીં રજૂ કરાવનારને કેટલી રકમનો દંડ ભરવો પડે છે?
11. બિનનિવાસી વ્યક્તિ માટે કયું પત્રક ભરવાનું હોય છે?
અ. GSTR- 5 બ. GSTR- 6
ક. GSTR- 7 ડ. GSTR- 8

12. માનવ વપરાશ માટેના દારૂ અને પેટ્રોલિયમ પેદાશો અને વીજળી પર લાગે છે?
13. ફરજિયાત નોંધણી માટે કેટલા માલનું ટર્નઓવર (ઉત્તર પૂર્વેના રાજ્યો માટે) હોય તો ફરજિયાત નોંધણી નંબર મેળવવો પડે છે.
અ. 20 લાખથી વધુ અને 75 લાખ બ. 40 લાખથી વધુ અને 95 લાખ
ક. 20 લાખથી વધુ અને 57 લાખ ડ. 20 લાખથી વધુ અને 1 કરોડ
14. અમુક કિસ્સામાં રીફંડ કોને મળવાપાત્ર છે?
15. આકસ્મિક વેરાપાત્ર વ્યક્તિ અથવા બિન-નિવાસી વેરાપાત્ર વ્યક્તિ એ ક્યારે નોંધણી માટે અરજી કરવાની હોય છે?

પ્ર.2. નીચેના પ્રશ્નોના જવાબો આપો (ગમે તે ચાર)

08

1. અમુક કિસ્સામાં રીફંડની જોગવાઈ સમજાવો.
2. ઈનપુટ ટેક્સ ક્રેડિટ શાની સામે સરભર થશે અને તેની સમય મર્યાદા જણાવો.
3. BCD, CVD, SCVD, ADD નું લાંબુ સ્વરૂપ આપો.
4. GST માં કરપાત્ર બનાવ એટલે શું?
5. ઓડિટ એટલે શું?
6. નોંધણી/પંજીકરણની અસરકારક તારીખ કઈ ગણાશે?
7. સ્વ આકારણી અંગે સમજાવો.

પ્ર.3. (અ) કસ્ટમ મુલ્યાંકનની પદ્ધતિઓ જણાવો અને કોઈપણ ત્રણ ઉદાહરણ સહિત સમજાવો.

07

(બ) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેઠળ પુરવઠાનું કાર્યક્ષેત્ર સમજાવો.

06

અથવા

પ્ર.3. (અ) કસ્ટમ કાયદા મુજબ કલમ 14 (1) અને કલમ 14 (2) કસ્ટમ ડ્યુટીનું મૂલ્યાંકન સમજાવો.

07

(બ) ગ્રાહક કલ્યાણ ફંડમાં કઈ રકમ જમા થાય છે અને તેનો ઉપયોગ જણાવો.

06

પ્ર.4. (અ) નીચેના પ્રશ્નોના જવાબ આપો (ગમે તે બે)

08

1. GST માં ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટેની શરતો જણાવો.
2. કસ્ટમ કરના પ્રકાર જણાવો. કોઈપણ ત્રણ ઉદાહરણ સહિત સમજાવો.
3. GST એક્ટ 2017 લેઠળ વેરાની ચૂકવણીના લક્ષણો સમજાવો.
4. માલ પુરવઠાનું સ્થળ અને સેવાના પુરવઠાનું સ્થળ.

પ્ર.4. (બ) ટૂંકનોંધ લખો (ગમે તે બે)

06

1. છેવટનું પત્રક અને વાર્ષિક પત્રક સમજાવો.
2. મિશ્ર પુરવઠો અને સંયુક્ત પુરવઠા વચ્ચેનો તફાવત સમજાવો.
3. આકસ્મિક વેરાપાત્ર વ્યક્તિ અથવા બિન-નિવાસી વેરાપાત્ર વ્યક્તિ
4. નોંધણીની અસરકારક તારીખ

ENGLISH VERSION

Q.1. Answer the objective questions

15

1. Write the long form of CBIT & C.
2. Which section is applicable for Consumer Welfare Fund?
(A) 57 (B) 75
(C) 58 (D) 85
3. According to the GST Act, to which of the following does section 59 apply?
(A) Self-assessment (B) Audit
(C) Provisional assessment (D) Refund

4. Give the long form of FOB.
5. Give the long form of CIF.
6. Who among the following is eligible for refund?
 - (A) SEZ
 - (B) EXPORTER
 - (C) United Nations or an organization designated by it
 - (D) All of the above
7. Which section is applicable for supply of goods or services?
 - (A) Section 12 and 13
 - (B) Section 12 and 11
 - (C) Section 13 and 14
 - (D) Section 10 and 11
8. CGST cannot be offset against which of the following ?
 - (A) CGST
 - (B) SGST/UGST
 - (C) IGST
 - (D) GST
9. Who is not eligible for input tax credit?
 - (A) For tax payable (levy)
 - (B) Non-resident
 - (C) Casual taxable person
 - (D) All the above
10. How much penalty is to be paid by the person who does not submit the return.
11. Which return is to be filed by a non-resident person?
 - (A) GSTR-5
 - (B) GSTR-6
 - (C) GSTR-7
 - (D) GSTR-8
12. _____ is levied on liquor and petroleum products for human consumption and electricity?
13. In case of North Eastern states, how much turnover of goods is necessary to obtain a compulsory registration number.
 - (A) More than 20 lakhs and 75 lakhs
 - (B) More than 40 lakhs and 95 lakhs
 - (C) More than 20 lakhs and 57 lakhs
 - (D) More than 20 lakhs and 1 crore
14. Who is eligible for refund in some cases?
15. When does a casual taxable person or a non-resident taxable person have to apply for registration?

Q.2. Answer in Brief (Any Four)

08

- (1) Explain the provisions of Refund.
- (2) Against what can Input tax credit be set off? Explain its time limit.
- (3) Give full form of BCD, CVD, SCVD, ADD.
- (4) What is a taxable event in GST.?
- (5) Explain meaning of an audit.
- (6) What will be the effective date of registration.?
- (7) Explain: self-assessment.

Q.3. (A) State the methods of customs valuation and explain any three methods with an example.

07

(B) Write scope of the supply under the GST Act.

06

OR

Q.3. (A) Explain the valuation of customs duty under section 14(1) and 14(2) of the Custom Act, 1962.

07

(B) Which amount is credited in consumer welfare funds and give its utilization.

06

Q.4. (A) Answer the following questions. (Any two)

08

- (1) State the conditions for availing input tax credit in GST ?
- (2) State the types of customs duty. Explain with any three examples.
- (3) Explain the features of payment of tax under GST Act 2017.
- (4) Place of supply of goods and services.

Q.4. (B) Write a short note. (Any two)

06

- (1) Final return and annual return.
 - (2) Difference between mixed supply and combined supply.
 - (3) Casual taxable person or non-resident taxable person
 - (4) Effective date of registration
-